



RUSHIL
DECOR LIMITED
WE'LL MAKE IT

RDL/046/2022-23

Date: 30.08.2022

To,
National Stock Exchange of India Ltd.
Exchange Plaza,
Bandra – Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
NSE EQUITY SYMBOL: RUSHIL

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400 001
BSE SCRIPT CODE: 533470

ISIN: INE573K01017

Dear Sir/Madam,

Ref: Regulation 47(1) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Sub: Intimation of publication of newspaper advertisements in respect of 28th Annual General Meeting of the Company

With reference to the above captioned subject, please find enclosed newspaper advertisements published in Business Standard (English) and Jai Hind (Gujarati) newspaper on Tuesday, 30th August, 2022, intimating that the 28th Annual General Meeting of the Company will be held on Tuesday, 27th September, 2022 at 11:15 A.M through Video Conferencing / Other Audio Visual Means in compliance with Circular Nos. 20/2020 , 02/2021, 19/2021, 21/2021, 2/2022 issued by Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 issued by Securities and Exchange Board of India.

The above information will also be available on the website of the Company at www.rushil.com

This is for your information and record.

Thanking You,


Yours Faithfully

For Rushil Decor Limited

Hasmukh K. Modi

Hasmukh K. Modi
Company Secretary

Encl.: a/a



RUSHIL DÉCOR LTD., RUSHIL HOUSE, NEAR NEELKANTH GREEN BUNGALOW,
OFF SINDHU BHAVAN ROAD, SHILAJ, AHMEDABAD-380058, GUJARAT, INDIA.

REGD. OFFICE: S. NO. 125, NEAR KALYANPURA PATIA, VILLAGE ITLA, GANDHINAGAR-MANSA ROAD,
TA. KALOL, DIST. GANDHINAGAR-382845, GUJARAT, INDIA. | CIN: L25209GJ1993PLC019532

PH: +91-79-61400400 | FAX: +91-79-61400401 | EMAIL: INFO@RUSHIL.COM | WWW.RUSHIL.COM

Amazon, Flipkart add 'scale-up' to their carts

Go into overdrive to expand warehousing capacity ahead of festival season

ISHITA AVAN DUTT & PEERZADA ABRAR
Haringhata/Bengaluru, 29 August

Step aside Cyber Monday, forget Black Friday, and watch out Singles' Day.

For bargain-hunting shoppers ready to loosen their purse strings this festival season, the country's two largest e-commerce platforms — Amazon and Flipkart — have gone into overdrive to scale up warehousing capacity.

Amazon rival Flipkart is girding up for its flagship The Big Billion Days (TBBD) sale event.

Fifty kilometres from Kolkata at Haringhata in the Nadia district of West Bengal, hiring at Flipkart's big-box facility is going full steam — around 400 people are joining every day! There is unlikely to be any let-up in the intensity as the Walmart-owned e-commerce major rolls out the red carpet.

The Haringhata facility, which happens to be Flipkart's largest fulfilment centre, started operations last year and is in ramp-up mode.

There are about 3,000-3,500 people currently working out of a massive box-like structure that sits on a 110-acre plot and has a built-up space of 2 million sq. ft with 5 million cubic feet of storage space spread across six mezzanine floors. From a robotics packaging arm to automated storage and retrieval system for faster movement of shipments, it flaunts state-of-the-art technology.

The facility — which has a processing capacity of 1 million shipments daily and can employ up to 11,000 people — will play an important role this season.

With TBBD probably less than two months away (the dates are yet to be announced), hiring is happening across Flipkart facilities — about 50,000 seasonal jobs will be added, taking the total workforce to 250,000. At the seller's end, it will create indirect employment through vendor and trucking partners.

From a preparation point of view for TBBD, Hemant Badri, senior vice-president, Flipkart, has a checklist ready: hiring the right kind of people, building the right inventory, and infrastructure-readiness.

Creating infrastructure has been an ongoing process for Flipkart. Manesar is next in line. South India will have one — the location for which is yet to be finalised.



FOR D-DAY

Amazon's preparation for the festival season

8: Fulfillment centres in Maharashtra with close to **8 million cubic feet** of storage space

■ Strengthening its engagement with the Indian Railways to move packages on **325 inter-city routes**

■ Launch delivery station spread across **22,000 sq. ft** in Ghaziabad

■ Launch of Northeast's first all-women delivery station in Mizoram

What to expect from Flipkart's TBBD 2022

40-50 million: New users with majority from tier 3 and 4 towns

► Highest ever operating warehousing space of **21 msf** for faster deliveries

50,000: Seasonal job creation, taking total workforce to **250,000**

► Customer orders to be shipped in nearly **5,000 EVs** — a step in building a green supply chain

A similar built-up area as the current one is proposed at Haringhata. At the existing Haringhata facility, the investment was to the tune of ₹1,500 crore.

Not to be left behind, Amazon India, too, has announced the expansion of its sortation and delivery network in Pune in the run-up to the festival season.

Amazon hosts its flagship event The Great Indian Festival (TGF) to catch the festive spirit. With this expansion, Amazon India will now have six sorting centres with more than 500,000 square (sq.) feet (ft) of sortation area, and close to 215 Amazon and partner delivery stations in Maharashtra. This infrastructural expansion will support more than 130,000 sellers in the state to reach a larger customer base, while offering a wider selection of products and faster deliveries this season. The newly launched sortation centre is spread across 125,000 sq. ft, facilitating the connection of packages to delivery stations in the city and parts of

Maharashtra, enabling quicker deliveries across the state.

"Maharashtra has always been an important state for us. This expansion reiterates our commitment to strengthen the local economy," says Abhinav Singh, director, customer fulfilment, supply chain and global speciality fulfilment, Amazon India, adding, "It also creates hundreds of work opportunities, including flexible earning opportunities, as we continue our long-term investment in infrastructure and technology."

The company also announced the expansion of its delivery network in Pune, with a new delivery station spanning 15,000 sq. ft. This station will enable Amazon India to strengthen its last-mile delivery network and ensure faster deliveries in Pune and in areas such as Jambhulwadi, Katraj, Askarwadi, Yewalewadi, and Bibwewadi.

More on www.business-standard.com

No plan to ban Chinese phones priced under ₹12,000: MoSIT

PRESS TRUST OF INDIA
New Delhi, 29 August

The government has asked Chinese mobile companies to increase their exports from India and there is no proposal to ban the sale of handsets below ₹12,000 made by such firms, Union minister Rajeev Chandrasekhar said on Monday.

The Minister of State for Electronics and IT also said that Indian companies also have a role to play in the

country's electronic ecosystem but it does not mean exclusion of foreign brands.

"Only issue that we have raised and done very transparently with some of the Chinese brands is that we have said that our expectation is that they will do more exports. Their supply chain, specially components supply

chain, need to be more transparent and much more open... (On) the other narrative about crowding them out from a particular segment (sub-₹12,000) of the market, we don't have any proposal and I am not sure where it came from," Chandrasekhar said.

He was responding to a question on a reported plan

Government has also asked Chinese mobile companies to increase their exports from India

of the government to bar Chinese companies from selling sub-₹12,000 mobile phones.

While releasing a report prepared by ICRIER in collaboration with industry body ICEA on increasing domestic value addition, the minister said the government is looking to reach \$300 billion-electronics production and exports of \$120 billion by 2025-26.

The present production is estimated to be around \$76 billion.

Minority investors likely to seek big dividend at Tata Sons AGM

Demand after firm makes huge profit; will lead to a total outflow of ₹404 cr

DEV CHATTERJEE
Mumbai, 29 August

With Tata Sons having announced a record high net profit for financial year 2021-22 (FY22), minority shareholders such as the Mistry family plan to seek a higher dividend from the company.

The dividend, after it is approved by shareholders on August 30, will lead to a total outflow of ₹404 crore for FY22.

The Mistry family will earn ₹75 crore as dividend income on its 18.5 per cent stake in the company.

The annual general meeting (AGM) will be chaired by executive chairman of Tata Sons N Chandrasekaran on Tuesday and is not open to the public.

Additional liabilities

Tata Sons has reported a massive ₹19,638-crore liability towards adjusted gross revenue (AGR) dues of Tata Teleservices, an unlisted subsidiary of the company.



BETTER BET

Tata Sons FY21 FY22 Standalone figures in ₹ cr

Source: Capitaline
Compiled by BS Research Bureau

Tata Sons has made provisions of ₹1,148 crore for AGR and is expected to make additional provisions in the years to come.

Tata Sons had earlier incurred ₹46,595 crore into Tata Teleservices to repay the loans of the loss-making firm.

It bought back a 50 per cent stake from NTT Docomo for \$1.2 billion in November 2017. Tata Sons will also have to make provisions for the accumulated losses of AirAsia India worth ₹2,600 crore.

Rising salaries

The shareholders are also expected to vote on the remuneration of directors of the Tata group holding company. According to the annual report, Ajay Piramal, chairman of Piramal group, earned a commission of ₹2.25 crore for FY21 while Bhaskar Bhat, former Titan head, earned a similar amount as commission on profits.

Venu Srinivasan, who is also vice-chairman of Tata Trusts, did not receive any compensation from Tata Sons as he abstained from receiving compensation from the company.

Independent director Harish Mawani received a commission on profit of ₹2.6 crore while non-executive director Ralf Speth took home a commission of a similar amount.

The commission will be paid after the shareholder meeting scheduled for Tuesday. Chandrasekaran received a compensation of ₹109 crore for FY22.

U.P. State Road Transport Corporation
Parivahan Bhavan, Tehri Kothi, 6 M.G. Marg, Lucknow-226001 (U.P.)
No. : 1502 FA/22-105FA/16 Dated : 29 Aug, 2022

Short Term-e-TENDER NOTICE
FOR RELEASING THROUGH REG. POST, e-portal & U.P. State Road Transport Corporation website
WHOM SO EVER IT MAY CONCERN

SUB.- TENDER NOTICE FOR THE ISSUANCE OF TERM GROUP INSURANCE POLICY FOR REGULAR EMPLOYEES APPOINTED/REAPPOINTED W.E.F. 01.04.2022 OR LEFT OVER EMPLOYEES

U.P. State Road Transport Corporation hereby invite e-tenders for the ISSUANCE OF TERM GROUP INSURANCE POLICY OF Rs. 4,00,000.00 (PER PERSON) FOR APPROX 3738 ± Employees for on year from insurers that are empanelled with INSURANCE REGULATORY AND DEVELOPMENT AUTHORITY (IRDA) and having a minimum of five (5) years of TERM GROUP INSURANCE business experience in India.

Prescribed tender forms containing all relevant details, terms and conditions can be downloaded from website of Govt. e-portal e-tender.up.nic.in.

DESCRIPTION	DATE AND TIME
Availability & e-submission of e-Tender On e-portal	W.e.f. 08.09.2022 up to 15:00 Hrs.
Opening of e-Tender document	07-09-2022 at 16:00 Hrs.

Detailed Bill of quantity, eligibility for participating in tender, other terms and conditions of the tender and calendar/timing of the tender may be seen on Govt. e-portal e-tender.up.nic.in.

Please do visit e-tender.up.nic.in from time to time before last date of submission of tender for any possible amendment/corrigendum/addendum.

For any query/clarification regarding submission of e-tender vendors may call on following helpline numbers of NIC - (1) 0522-2286808 (2) 0522-2286809 (3) 0522-4130303 (4) 0522-2298813

Finance Controller

COMFORT FINCAP LIMITED
CIN: L65923WB1982PLC035441
Registered Office: 22, Camac Street, Block 'B', Kolkata-700016, West Bengal; Corporate Office: A-301, Hotel Arch, S. V. Road, Malad (West), Mumbai-400064; Phone No. : 022-6894-8500/08/09; Fax: 022-2889-2527; Email : info@comfortincap.com; Website : www.comfortincap.com

NOTICE OF 40TH ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

In continuation of our newspaper notice published on Sunday, August 28, 2022, NOTICE is hereby given that the 40TH Annual General Meeting (AGM) of the Members of COMFORT FINCAP LIMITED (the "Company") will be held on **Wednesday, September 21, 2022 at 11:00 A.M. (IST)** through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM), to transact the business as stated in the AGM Notice, in compliance with the applicable provisions of the Companies Act, 2013 (the Act) and the rules made thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI Listing Regulations), read with the Ministry of Corporate Affairs ("MCA") circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021, December 14, 2021 and May 5, 2022 (collectively referred to as "MCA Circulars") and The Securities and Exchange Board of India vide its Circular No. SEBI/HO/CFD/CMD/ICIR/P/2020/79 dated May 12, 2020, SEBI/HO/CFD/CMD/ICIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/CMD/ICIR/P/2022/62 dated May 13, 2022 (collectively referred to as "SEBI Circulars") and all other relevant circulars issued, without the physical presence of the Members at a common venue.

The Annual Report of the Company including AGM Notice for the financial year ended March 31, 2022 ("Annual Report") were sent through electronic mode only to all those members whose email id's are registered with Company or its Registrar and Transfer Agent or the Depositories, in accordance with the MCA circulars and the SEBI circulars and the same has been completed on Monday, August 29, 2022. Members can join and participate in the AGM through VC/ OAVM facility only. The instructions for joining the AGM and the manner of participating in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Annual Report is also available on the Company's website at <http://www.comfortincap.com/investorrelation> and on the website of the Stock Exchange i.e. BSE Limited's website at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com (agency for providing the e-voting facility).

Members holding shares in physical mode and/ or who have not registered/updated their email address with the Company's Registrar and Transfer Agent/ the Depositories and/ or who has acquired shares and become the members of the Company after the dispatch of notice and holding shares as of the cut-off date, i.e. September 14, 2022 can obtain Annual Report from website of Company's Stock Exchange/ NSDL and/or login details for joining the AGM through VC/OAVM facility including e-voting by sending scanned copy of: a) Copy of the signed request letter mentioning the folio number/ DP ID and Client Id, name and address of the member; b) Self - attested copy of PAN Card; and c) Self-attested copy address proof (eg. Aadhar, Driving license, Election Identity Card, Passport) of the member by email to info@comfortincap.com, info@qisgarsonline.com and evoting@nsdl.co.in.

NOTICE is also hereby given that pursuant to the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of SEBI Listing Regulations, the Company is providing a facility to the members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said meeting ("e-voting"). The Company has availed the services of NSDL to provide the facility of remote e-voting/ e-voting at the AGM. Members whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the meeting. The voting rights of Members shall be in proportion to their shares in paid up equity capital of the Company as on cut-off date i.e. September 14, 2022.

The Remote e-voting shall commence on September 18, 2022 at 09:00 A.M. (IST) and ends on September 20, 2022 at 05:00 P.M. (IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. September 14, 2022 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by the NSDL for voting thereafter. The facility of e-voting will also be made available at the AGM. Only those members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting and are otherwise not barred from doing so, will be able to vote at the AGM. A member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.

Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the AGM Notice and holding shares as of the cut-off date may obtain login id and password by sending a request at evoting@nsdl.co.in and also refer to the voting instructions on the NSDL website. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/ she can use his/her existing User ID and password for casting vote or following the procedure as mentioned in the AGM Notice. Further, any person, who ceases to be the Member of the Company as on the cut-off date and is in receipt of this communication, shall treat the same for information purpose only.

The details instructions for joining the AGM through VC/ OAVM and casting the vote through remote e-voting/ e-voting at the AGM is provided in the Notice of the AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance and/ or having any grievances before or during the AGM regarding e-voting facility and/ or VC/ OAVM facility, can send a request to Mr. Anubhav Saxena, Assistant Manager, National Securities Depository Limited, Trade World, A wing, 4th Floor, Kamala Mills Compound, Lower Parel, Mumbai - 400013 at evoting@nsdl.co.in or call on toll free no. 1800-1020-990/1800224430 or email at info@comfortincap.com or call at Tel. No. 022-68948508/09.

NOTICE is also hereby given that pursuant to section 91 of the Act read with Rules made thereunder, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 15, 2022 to Wednesday, September 21, 2022 (both days inclusive) for the purpose of Annual General Meeting.

BY ORDER OF THE BOARD OF DIRECTORS OF COMFORT FINCAP LIMITED

Sd/-
SNEHA MANDELA
COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

DATE: AUGUST 30, 2022
PLACE: MUMBAI

RUSHIL DECOR LIMITED
Regd. Office: S. No. 125, Near Kalyangirga Patta, Village Ila, Gandhinagar-mansa Road, Ta. Kalol, Dist. Gandhinagar-382845, Gujarat, India.
Corporate Office: Rushil House, Near Neelkanth Green Bungalow, Off Sindhu Bhavan Road, Shilaj, Ahmedabad-380058, Gujarat, India.
Ph: +91-79-61400401 | Fax: +91-79-61400401
Email: info@rushil.com | www.rushil.com
CIN: L28209GJ1993PLC019532

NOTICE OF 28TH (TWENTY EIGHTH) ANNUAL GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO CONFERRING ("VC") / OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that in compliance with General Circular No. 20/2020 dated May 5, 2022, 2021 dated January 13, 2021, 19/2021 dated December 8, 2021, 21/2021 dated December 14, 2021 and 2/2022 dated May 5, 2022 issued by Ministry of Corporate Affairs (MCA) read with Circular No. SEBI/HO/CFD/CMD/ICIR/P/2022/62 dated May 13, 2022 issued by the Securities and Exchange Board of India (SEBI) (collectively referred to as "Circulars") and in compliance with all other applicable laws, the 28th Annual General Meeting ("AGM") of the members of **RUSHIL DECOR LIMITED** will be held at 11.15 A.M. on **Tuesday, 27th day of September, 2022 through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM)** to transact the businesses as set out in the Notice of AGM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report for the Financial Year 2021-22 will be sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Registrar and Transfer Agents (RTA)/Depository Participants. Members holding shares in dematerialized mode and whose e-mail address are not registered are requested to register their e-mail addresses with their relevant Depository Participants. Members may note that the Notice of AGM and Annual Report for the Financial Year 2021-22 will also be available on the Company's website at www.rushil.com, website of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and at National Stock Exchanges India Limited at www.nseindia.com and the AGM Notice will also be available on the website of NSDL (agency for providing the Remote e-voting facility) at <https://www.evoting.nsdl.com/> in due course. Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM will be provided in the Notice of AGM.

Pursuant to Provision of Section 91 of the Companies Act 2013 and Rule 10 of the Companies (Management and Administration) Rules 2014, the Register of Members and Share Transfer Books of the Company will remain close on **Wednesday, 21st day of September, 2022 to Tuesday, 27th September, 2022** (both days inclusive) for the purpose of determining the entitlement of final dividend of ₹ 0.50 (fifty paise) per equity share of ₹ 10/- each (@5%) as recommended by the Board, for the financial year 2021-22 on the paid up equity share capital of the Company, if declared at the ensuing Annual General Meeting.

Members holding shares either in physical form or dematerialized form, as on cut-off date **Tuesday, 20th day of September, 2022** may cast their vote electronically on the business as set in the notice of AGM through electronic voting system of NSDL from a place other than venue of AGM (Remote e-voting).

The Remote e-voting shall commence on **Friday, 23rd day of September, 2022 (9:00 AM IST)** and ends on **Monday, 26th day of September, 2022 (5:00 PM IST)**.

Members will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of remote e-voting and e-voting during the AGM for members holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the members.

Members may please note that in terms of aforementioned Circulars, the Company will not be sending physical copies of AGM Notice and Annual Report to the Members.

For, Rushil Decor Limited
Sd/-
Hasmukh K. Modi
Company Secretary

Date: 29.08.2022
Place: Ahmedabad

— TENDER CARE —

— Advertorial

ENGINEERS INDIA LIMITED — CSR INITIATIVE

Engineers India Limited (EIL), New Delhi had sanctioned under CSR initiative through National Backward Classes Finance & Development Corporation (NBCFDC), New Delhi for conducting Skill Development Training Programme for the benefit of 600 Other Backward Classes youth at CIPET Centres located across the country in the year 2021-22. CIPET Centres had successfully commenced and completed the training programme. Out of 600 candidates admitted, 575 candidates had successfully completed the training programme of which 511 candidates had been provided employment opportunities. Through this training programme, EIL has created skills sets among youths who are the major driving force for economic development. The socio-economic status of the beneficiaries and their family has been uplifted and their livelihood has been improved.

INTERNATIONAL CONFERENCE ON INDIAN MINERALS AND METALS INDUSTRY ORGANISED BY NMDC AND FICCI

NMDC in association with FICCI organised a two-day conference on Indian minerals and metals industry on the theme 'Transition Towards 2030 & Vision 2047' on 23rd & 24th August at Taj Palace, New Delhi. For the Valedictory function, Chief Guest Faggun Singh Kulaste, Minister of State for Steel and Rural Development; Sanjay Kumar Singh, IAS, Secretary, Ministry of Steel; Sumit Deb, CMD, NMDC; Arun Chawla, Director General, FICCI; Kundan Kumar, Advisor, NITI Aayog; Ila Patnaik, Chief Economist, Aditya Birla Group; and Sunil Duggal, Whole Time Director and CEO, Vedanta Group were also present. NMDC's Directors - Amitava Mukherjee, Director (Finance) and Dilip Kumar Mohanty, Director (Production) were present on both days of the conference.

UNION MoS FOR NEW & RENEWABLE ENERGY PRESENTS AWARD TO CMD, IREDA

Indian Renewable Energy Development Agency Ltd. (IREDA) received an award from the Association of Renewable Energy Agencies of States (AREAS) for best performance in the Renewable Energy Sector during 2021-22. Bhagwanth Khuba, Minister of State for New and Renewable Energy and Chemicals and Fertilisers, presented the award to Pradip Kumar Das, Chairman & Managing Director (CMD), IREDA, in the presence of K. Krishnankutty, Electricity Minister of Kerala and Indu Shekhar Chaturvedi, Secretary, Ministry of New & Renewable Energy (MNRE). IREDA has been selected for the prestigious award for achieving the highest amount of loan sanctioned and disbursed for Renewable Energy projects during 2021-22 amongst Non-Banking Financial Companies (NBFCs). In his acceptance address after receiving the award, CMD, IREDA said: "We would not have been able to reach these stellar heights without the persistent efforts of our employees as well as guidance and support from MNRE & Govt. of India. We are grateful to MNRE and AREAS for considering IREDA for this award."

BANK OF BARODA LAUNCHES THE BoB WORLD YODHA DEBIT CARD FOR INDIA'S ARMED FORCES

Bank of Baroda recently announced the launch of the BoB World Yodha Debit Card on the RuPay platform, especially for the Indian Armed Forces. As India marks 75 years of independence, the premium, feature-rich RuPay Select Debit Card is a special offering, designed to meet the needs of the country's Uniformed Personnel and Veterans. The BoB World Yodha Debit Card, linked to the Baroda Defence Salary Package, offers higher transaction limits, personal accident & total disability insurance cover of Rs 10 lakh and is completely complimentary with the joining and annual fees waived off. Akhil Handa, Chief Digital Officer, Bank of Baroda said, "We are delighted and honoured to launch the bob World Yodha Debit Card, a premium, high-end card offering a basket of features, services and offers customised for our Defence Forces. Over the years, Bank of Baroda has developed a long-standing relationship with the Indian Armed Forces and has introduced specially curated salary savings accounts. With a host of exclusive features and offers revolving around health, fitness and overall well-being, the BoB World Yodha Debit Card will enhance the overall experience of our valued customers."

HPCL COMMENCES ITS FIRST COWDUNG TO COMPRESSED BIOGAS PROJECT

In a transcending move towards Green energy and commitment towards environmental stewardship, HPCL commenced its Cowdung to Compressed Biogas Project at Sanchore, Rajasthan. This will be HPCL's first project under Waste to Energy portfolio. The plant is proposed to utilize 100 Tons per day of dung to produce biogas, which can be utilized as automotive fuel. The project is proposed to be commissioned in a year's time. The project's ground breaking ceremony took place at Shree Godham Mahatirh Pathmeda Lok Punyarth Nyas, Village Pathmeda, Tehsil Sanchore District Jalore in Rajasthan which was attended by ED - Bio-fuel & Renewables, Shuvendu Gupta and Senior officials from HPCL.

The project is being developed under GOBAR-Dhan scheme launched by Government of India in Apr'18 as a part of the Biodegradable Waste Management component under Swachh Bharat Mission (Grameen) to positively impact cleanliness and generate wealth and energy from cattle and organic waste.

PNB TAKES PHYSICAL POSSESSION OF JATADHARI RICE MILL AT SIJGRAM VILLAGE

Punjab National Bank has taken Physical Possession of Jatadhari Rice Mill, at Sijgram Village, Bharatpur P.S. under Kandi Sub Division at Murshidabad as measure under SARFAESI Act 2002. The Bank, on Monday, has taken physical possession of the Rice Mill and put the Notice under SARFAESI Act, 2002. Saikat Nag, Circle SASTRA Head & Avijit Mondal, Chief Manager, Circle Office have informed that they are going to sale the property within a very short period. According to the Bank, the NPA portfolio is due to unwillingness of the borrowers towards timely repayment of the Bank dues. So the Bank Administration has become very strict now towards NPA recovery. The Bank is trying for more recovery of the Bad Debt through SARFAESI action.

